



Market News

આજના કારોબારી દિવસે ભારતીય બજાર વધારાની સાથે બંધ થયા છે. આજે નિફ્ટી 23900 ની ઊપર બંધ થયા જ્યારે સેન્સેક્સે 79117 પર બંધ થયા. આજના કારોબારમાં નિફ્ટીએ 23,956.10 સુધી ઉછળી તો સેન્સેક્સ 79,218.19 સુધી પહોંચ્યો હતો.

ભારતીય રૂપિયો 5 પૈસા વધીને 84.45 ના સ્તર પર બંધ થયો. જ્યારે સોમવારે ભારતીય રૂપિયો 84.50 ના સ્તર પર બંધ થયો હતો.

સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં મજબૂતી જોવા મળી. એનએસઈના મિડકેપ ઈન્ડેક્સ 1.16 ટકા તેજીની સાથે 55,016.85 ના સ્તર પર બંધ થયા છે. જ્યારે એનએસઈના સ્મોલકેપ ઈન્ડેક્સ 0.90 ટકા વધારાની સાથે 17,755.55 પર બંધ થયા છે.

અંતમાં બીએસઈના 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 1,961.32 અંક એટલે કે 2.54% ની મજબૂતીની સાથે 79,117.11 ના સ્તર પર બંધ થયા છે. તો એનએસઈના 50 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી 557.40 અંક એટલે કે 2.39% ની વધારાની સાથે 23,907.30 ના સ્તર પર બંધ થયા છે.

રેમંડના શેરોમાં આજે ખરીદારીનું સારા વલણ દેખાય અને આ 7 ટકાથી વધારે ઉછળી ગયા. તેનું કારણ એ છે કે કંપની પોતાના રિયલ્ટી કારોબાર Raymond Realty ના શેરોને અલગથી લિસ્ટ કરવા વાળી છે જે બીએસઈ અને એનએસઈથી 'નો ઓબ્જેક્શન' પત્ર મળી ગયો છે. કંપનીએ આ માઈલસ્ટોન લાઈફ સ્ટાઈલ

બિઝનેસના ડીમર્જરના પૂરા થયાની બાદ આશરે બે મહીના બાદ હાસિલ કર્યો છે. તેના ચાલતા રેમંડના શેર 6.83 ટકાના વધારાની સાથે 1524.00 રૂપિયાના ભાવ પર છે. ઈટ્રા-ડે માં તે 7.66 ટકા ઉછળીને 1535.80 રૂપિયાના ભાવ પુર પહોંચી ગયો હતો.

રેમંડ અને રેમંડ રિયલ્ટીની અલગ-અલગ લિસ્ટિંગના બોર્ડની 4 જુલાઈ 2024 ના મંજૂરી મળી ગઈ હતી. યોજનાની હેઠળ રેમંડ રિયલ્ટીના 10 રૂપિયાની ફેસ વૈલ્યુ વાળા 6.65 કરોડ શેર રજૂ થશે અને રેમંડના શેર હોલ્ડર્સના એક શેરના બદલે એક શેર રેમંડ રિયલ્ટીને મળશે. અલગ-અલગ લિસ્ટિંગ થવાથી રોકાણકારોને તેની રિયલ્ટી કારોબારમાં અલગથી પૈસા લગાવાની તક મળશે.

આ મામલે અદાણી ગ્રુપ તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે. ગ્રુપનું કહેવું છે કે તેણે હંમેશા તમામ કાયદાકીય નિયમોનું પાલન કર્યું છે અને તે આ બાબતે સંભવિત કાનૂની વિકલ્પો પર વિચાર કરી રહ્યું છે. કંપની સામેના તમામ આરોપો પાયાવિહોણા છે. અમેરિકી કોર્ટમાં લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.

અદાણી ગ્રૂપના પ્રવક્તાએ કહ્યું છે કે યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ અને યુએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ કમિશન દ્વારા અદાણી ગ્રીનના ડિરેક્ટરો પર લગાવવામાં આવેલા આરોપો પાયાવિહોણા છે.

Results & Corporate Action

MARKET-HUB	
	Result Calendar
DATE :- 25-11-24	COMPANY NAME : <u>JAINEX AAMCOL LTD.</u> <u>ACME SOLAR HOLDINGS LTD.</u>
DATE :- 26-11-24	COMPANY NAME : <u>ANSAL PROPERTIES & INFRASTRUCTURE LTD.</u>
DATE :- 27-11-24	COMPANY NAME : <u>HARISH TEXTILE ENGINEERS LTD.</u>
DATE :- 29-11-24	COMPANY NAME : <u>ASHIANA ISPAT LTD.</u>
DATE :- 30-11-24	COMPANY NAME : <u>MINAL INDUSTRIES LTD.</u>

MARKET-HUB				
Corporate Action				
Corporate Action	Company	Type & Percentage	Record Date	Ex-Date
Bonus	<u>Shakti Pumps</u>	Bonus Ratio 5:1	25/11/2024	25/11/2024
Bonus	<u>Raghav Product</u>	Bonus Ratio 1:1	29/11/2024	29/11/2024
Dividend	<u>Power Finance</u>	Dividend (Rs) 3.50	25/11/2024	25/11/2024
Dividend	<u>Sun TV Network</u>	Dividend (Rs) 5.00	26/11/2024	26/11/2024
Dividend	<u>Kaveri Seed</u>	Dividend (Rs) 5.00	26/11/2024	26/11/2024
Dividend	<u>Polyplex Corp</u>	Dividend (Rs) 9.00	26/11/2024	26/11/2024
Dividend	<u>Morganite India</u>	Dividend (Rs) 30.00	26/11/2024	26/11/2024
Dividend	<u>Ingersoll Rand</u>	Dividend (Rs) 55.00	27/11/2024	27/11/2024
Dividend	<u>Multibase India</u>	Dividend (Rs) 53.00	27/11/2024	27/11/2024
Dividend	<u>Bayer CropScien</u>	Dividend (Rs) 90.00	28/11/2024	28/11/2024
Dividend	<u>Godfrey Phillip</u>	Dividend (Rs) 35.00	29/11/2024	29/11/2024

Nifty Fut in Last Week:-

ઉપરમાં ૨૩૫૫૮.૭૦ અને નીચામાં ૨૩૨૭૭.૦૦ નો ભાવ જોવા મળ્યો હતો.



NIFTY WEEKLY CHART



BANKNIFTY WEEKLY CHART

Nifty Fut in Upcoming Week:-

NIFTY નીચામાં ૨૩૫૦૦ નો support છે ઉપરમાં ૨૪૦૫૦ cross કરતા ૨૪૪૦૦ થી ૨૪૬૦૦ સુધી નો ભાવ જોઈ શકાય.

Bank Nifty Fut in Upcoming week:-

BANK NIFTY નીચામાં ૪૯૮૦૦ નો support છે ઉપરમાં ૫૨૩૦૦ થી ૫૨૫૦૦ નો ભાવ જોઈ શકાય.

Recommendation for next week

Serial No.	Stock Name Cash segment	Above Below / Add HOLD	CMP as on 23.11.2024	Trail SL	Buy Stop loss	Sell Stop loss	Target
1	IDFCFIRSTB(BUY)	ADD 63-60-55	63		50		80
2	RADICO (BUY)	ABOVE 2335	2285		2185		2600
3	INDHOTEL(BUY)	HOLD 739	799	732			850

Commodity Market

COPPER CMP(813):- ઉછાળે ૮૫૭ ના s1 થી વેચાણ કરી શકાય નીચામાં ૭૮૫ સુધી નો ભાવ આવી શકે.



CRUDEOIL CMP(6033):- ઘટાડે ૫૮૦૦ ની રેન્જમાં ખરીદી કરી શકાય ૫૭૦૦ નો s1 રાખવો ઉપરમાં ૬૩૦૦ સુધી નો ભાવ આવી શકે.

SILVER CMP(90791):- નીચામાં ૮૫૫૦૦ નું level ૨૦૦ દીવસ ની ema છે જો આ લેવલ નીચે close નહી આપે તો ઉપરમાં ૯૨૦૦૦ થી ૯૪૦૦૦ નો ભાવ જોઈ શકાય.



GOLD CMP(77685):- નીચામાં ૭૧૨૦૦ નું level ૨૦૦ દીવસ ની ema support છે ઉછાળે વેચાવલી જોવા મળે ઉપરમાં ૭૮૮૫૫ નું strong resistance છે.

નાણાકીય સફળતા માટે હવે અપનાવવા માટેના 7 સચોટ સિદ્ધાંતો
(ભાગ : 1)

હોલી બર્ન્સ દ્વારા પ્રસ્તુત, અમે આ લેખ

<https://www.newtraderu.com/2024/10/31/7-stoic-principles-to-adopt-now-for-financial-success/> પરથી લીધો છે. સ્ટોઇક ફિલોસોફી હંમેશા શાણપણ અને વ્યવહારુ પાઠોથી ભરેલી રહી છે. તે વાંચવા અને આપણા જીવનમાં અમલમાં મૂકવા યોગ્ય છે



પૂર્વે 3જી સદીની શરૂઆતમાં એથેન્સમાં જન્મેલા સ્ટોઇકિઝમની પ્રાચીન ફિલસૂફી, હેતુ, સ્થિતિસ્થાપકતા અને પરિપૂર્ણતાનું જીવન જીવવા માટે એક ઉત્તમ માળખા તરીકે સમયની કસોટી પર ઊભેલી છે. ઘણીવાર વ્યક્તિગત નૈતિકતા અને ભાવનાત્મક નિયમનની થીમ્સ સાથે સંકળાયેલા હોવા છતાં,

સ્ટોઈકિઝમનું શાણપણ નાણાકીય વ્યવસ્થાપન સહિત જીવનના તમામ પાસાઓ સુધી વિસ્તરે છે.

આર્થિક અનિશ્ચિતતા, બજારની અસ્થિરતા અને સંપત્તિની અવિરત શોધ દ્વારા ચિહ્નિત થયેલ સમયમાં, ફાઇનાન્સ માટેનો સ્ટોઈક અભિગમ એક પ્રેરણાદાયક પરિપ્રેક્ષ્ય પ્રદાન કરે છે જે સદ્ગુણ, સંતોષ અને ટૂંકા ગાળાના લાભો અને ભૌતિક અધિકતા પર લાંબા ગાળાની વિચારસરણી પર ભાર મૂકે છે. આ કાલાતીત સિદ્ધાંતોને અપનાવીને, આપણે આધુનિક નાણાકીય વિશ્વની જટિલતાઓને વધુ સ્પષ્ટતા, શિસ્ત અને મનની શાંતિ સાથે નેવિગેટ કરી શકીએ છીએ.

1. તમે શું નિયંત્રિત કરી શકો તેના પર ધ્યાન કેન્દ્રિત કરો

સ્ટોઈસીઝમના કેન્દ્રીય સિદ્ધાંતોમાંનું એક નિયંત્રણની દ્વિભાષા છે - એ વિચાર કે જે આપણા નિયંત્રણની બહાર છે તે સ્વીકારીને આપણે શું પ્રભાવિત કરી શકીએ તેના પર આપણે આપણી શક્તિને કેન્દ્રિત કરવી જોઈએ. નાણાના ક્ષેત્રમાં, આ સિદ્ધાંત ખાસ કરીને સુસંગત છે. જ્યારે આપણે બજારની વધઘટ, આર્થિક ચક્ર અથવા વ્યક્તિગત શેરોના પ્રદર્શનને નિયંત્રિત કરી શકતા નથી, ત્યારે અમે અમારા નાણાકીય નિર્ણયો અને વર્તનને નિયંત્રિત કરી શકીએ છીએ.

અમે અમારા નિયંત્રણમાં રહેલા પરિબળો, જેમ કે આપણો બચત દર, ખર્ચ કરવાની ટેવ અને રોકાણની પસંદગીઓ પર ધ્યાન કેન્દ્રિત કરીને સશક્તિકરણ અને જવાબદારીની ભાવના કેળવી શકીએ છીએ. બજારની દરેક હિલચાલની આગાહી કરવા અથવા તેના પર પ્રતિક્રિયા આપવાના પ્રયાસની ચિંતા અને તાણને વશ થવાને બદલે, આપણે એ જાણીને દિલાસો મેળવી શકીએ છીએ કે આપણી નાણાકીય સુખાકારી આખરે આપણી ક્રિયાઓ અને વલણ પર આધારિત છે.

2. સંતોષ અને કૃતજ્ઞતા કેળવો

એવી દુનિયામાં કે જે આપણને વધુ ઈચ્છવા માટે સતત પ્રોત્સાહિત કરે છે, સ્ટોઈસીઝમ આપણને યાદ અપાવે છે કે આપણી પાસે જે છે તેમાં સંતોષ શોધવાનું. સંતોષનો આ સિદ્ધાંત ઓછા માટે સમાધાન કરવા અથવા મહત્વાકાંક્ષા વિશે ભૂલી જવા વિશે નથી, પરંતુ આપણા જીવનમાં પહેલેથી જ વિપુલતાને ઓળખવા અને તેની પ્રશંસા કરવા વિશે છે.

જ્યારે પર્સનલ ફાઇનાન્સ પર લાગુ કરવામાં આવે છે, ત્યારે સંતોષની પ્રથા આપણી ખર્ચ કરવાની ટેવ અને એકંદર નાણાકીય સ્વાસ્થ્ય પર ઊંડી અસર કરી શકે છે. કૃતજ્ઞતા પર ધ્યાન કેન્દ્રિત કરીને અને સાદા આનંદમાં આનંદ મેળવવાથી, આપણે આવેગજન્ય અથવા બિનજરૂરી ખર્ચમાં જોડાવાની લાલચનો પ્રતિકાર કરી શકીએ છીએ. આપણે આપણી જરૂરિયાતો અને ઉપભોક્તાવાદ અને સામાજિક સરખામણી દ્વારા ઉશ્કેરાયેલી ક્ષણિક ઇચ્છાઓ વચ્ચે તફાવત કરવાનું શીખી શકીએ છીએ.

3. લાંબા ગાળાના વિચારને અપનાવો

બજારની અસ્થિરતા અને આર્થિક અનિશ્ચિતતાના ચહેરામાં, તે ટૂંકા ગાળાના લાભો અથવા ભાવનાત્મક પ્રતિક્રિયાઓના આધારે નાણાકીય નિર્ણયો લેવા માટે લલચાવી શકે છે. જો કે, સ્ટોઈસીઝમ આપણને લાંબા ગાળાના પરિપ્રેક્ષ્યને અપનાવવા પ્રોત્સાહિત કરે છે, તે માન્યતા આપે છે કે સાચી નાણાકીય સફળતા એ મેરેથોન છે, સ્પ્રિન્ટ નથી.

આ લાંબા ગાળાના અભિગમને રોકાણમાં વ્યાપક સંશોધન દ્વારા સમર્થન મળે છે. અભ્યાસો સતત દર્શાવે છે કે જે રોકાણકારો દર્દી, શિસ્તબદ્ધ અભિગમ જાળવી રાખે છે, તેમના લાંબા ગાળાના ધ્યેયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ટૂંકા ગાળાના ઘોંઘાટની અવગણના કરે છે, તેઓ બજારની વધઘટ પર સતત પ્રતિક્રિયા આપતા હોય તેવા લોકો કરતાં આગળ વધે છે.

4. સ્વ-શિસ્ત અને વિલંબિત પ્રસન્નતાનો અભ્યાસ કરો

સ્વ-શિસ્તનો ઉપયોગ કરવાની ક્ષમતા અને પ્રસન્નતામાં વિલંબ એ સ્ટોઈક ફિલસૂફીની ઓળખ છે - અને નાણાકીય સફળતામાં નિર્ણાયક ઘટક છે. ત્વરિત પ્રસન્નતા અને સરળ ધિરાણની દુનિયામાં, લાંબા ગાળાની સલામતી કરતાં આપણા અર્થ કરતાં વધુ ખર્ચ કરવાની અથવા ટૂંકા ગાળાના આનંદને પ્રાધાન્ય આપવાની લાલચનો પ્રતિકાર કરવો મુશ્કેલ હોઈ શકે છે, જો કે, આપણે સ્વ-કેળવીને નાણાકીય સ્થિરતા અને વૃદ્ધિ માટે મજબૂત પાયો બનાવી શકીએ છીએ. શિસ્ત અને ભવિષ્યના લાભોની તરફેણમાં તાત્કાલિક પુરસ્કારો મુલતવી રાખવાનું શીખવું. આમાં બજેટિંગ તકનીકોનો અમલ, સ્વચાલિત બચત અથવા

આવેગજન્ય ખરીદીઓને રોકવા માટે "30-દિવસના નિયમ" જેવા સાધનોનો ઉપયોગ શામેલ હોઈ શકે છે.

5. તમારી જાતને સતત શિક્ષિત કરો

પ્રાચીન સ્ટોઇક્સ શિક્ષણ અને સ્વ-સુધારણાની શક્તિમાં દ્રઢ વિશ્વાસ ધરાવતા હતા, તેઓ માન્યતા આપતા હતા કે સાચું શાણપણ શીખવાની આજીવન પ્રતિબદ્ધતામાંથી આવે છે. વ્યક્તિગત નાણામાં, આ સિક્કાંત નાણાકીય સાક્ષરતા અને શિક્ષણ માટે સક્રિય અભિગમમાં અનુવાદ કરે છે.

એવી દુનિયામાં જ્યાં નાણાકીય ઉત્પાદનો, નિયમો અને શ્રેષ્ઠ પ્રથાઓ સતત વિકસિત થઈ રહી છે, માહિતગાર અને અપ-ટૂ-ડેટ રહેવું જરૂરી છે. વ્યક્તિગત ફાઇનાન્સ, રોકાણ અને અર્થશાસ્ત્ર વિશે શીખવા માટે સમય ફાળવીને, અમે વધુ માહિતગાર નિર્ણયો લઈ શકીએ છીએ, સામાન્ય મુશ્કેલીઓ ટાળી શકીએ છીએ અને બદલાતા સંજોગોને સ્વીકારી શકીએ છીએ.

HEAD OFFICE

B/230-231, International Trade Center, Majura Gate, Ring Road, Surat-2. (Guj.) India Ph: 0261-40 60 750,
246 27 90 Fax: 0261-246 27 91 www.markethubonline.com E-Mail: info@markethubonline.com

IA SEBI REGISTRATION NO.:INA000005333

Disclaimer:

We do not represent that information provided by us is accurate or complete and it should not be relied upon as such. The advice provided here is just for knowledge purpose only. The user assumes the entire risk of any use made or not made of this information. INVESTMENT IN EQUITY, MUTUAL FUND, EQUITY, CURRENCY & COMMODITY DERIVATIVES IS SUBJECT TO RISK. WE ARE DISTRIBUTOR OF MUTUAL FUND Client should read the Risk Disclosure Document (RDD) & Do's and Don'ts issued by SEBI & relevant exchanges before investing